



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટના ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ એપ્રિલ 27 થી બંધ થશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 23, 2020) – COVID-19 કટોકટી દરમિયાન બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના સમુદાયને સુરક્ષિત રીતે સેવા આપતું હોવાની ખાતરી કરાવવા, ટ્રાન્ઝિટના ટર્મિનલ્સ (બ્રેમલી ટર્મિનલ, બ્રેમ્પટન ગેટવે ટર્મિનલ, ડાઉનટાઉન ટર્મિનલ) પરના કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ એપ્રિલ 27 થી આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે. ટર્મિનલની ઈમારતો વોશરૂમ સગવડોમાં પ્રવેશવા દેવા ખુલ્લી રાખવામાં આવશે. વધુમાં, ટ્રિનિટી કોમન ટર્મિનલ બિલ્ડિંગ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે.

અમારા ટર્મિનલ્સમાં કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સમાં તાજેતરના અઠવાડિયાઓમાં બહુ ઓછો વ્યવહાર જોવામાં આવ્યો છે, મોટા ભાગે ટ્રાન્ઝિટના સંચાલનમાં ફેરફારોને લીધે જેમ કે, ઘટાડેલી સર્વિસ અને ફ્રી ફેર્સ.

પોતાના PRESTO કાર્ડ્સમાં બેલેન્સ જમા કરાવવા ઈચ્છતા ઉત્કરુઓ વેબસાઈટ www.PRESTOcard.ca પર ઓનલાઈન અથવા બ્રેમલી ટર્મિનલ અને ડાઉનટાઉન ટર્મિનલ પર ઉપલબ્ધ PRESTO ટિકિટ વેન્ડિંગ મશીન્સમાં તે કરાવી શકે છે. સમયપત્રકો અને પ્રવાસ આયોજન માટે, ઉત્કરુઓ કનેક્ટ સેન્ટર મારફતે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સાથે 905.874.2999 નંબર પર જોડાઈ શકે છે.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉત્કરુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca